

ત્વરિત જાહેરાત માટે

બ્રેમ્પટનના હિમાયતી પ્રયાસોને પરિણામે લઘુ વ્યવસાયો માટે ભાડામાં રાહત મળેલ છે

બ્રેમ્પટન, ઓન્ટારિયો (24 એપ્રિલ 2020) – આજે બ્રેમ્પટનના હિમાયતી પ્રયાસો ફલિત થયા અને ફેડરલ સરકારે ઘોષણા કરી કે તેઓ તમામ પ્રોવિન્સો અને પ્રદેશો સાથે સૈદ્ધાંતિક સંમતિ સાધી શક્યા છે કે તેઓ નાના વ્યવસાયો માટે કેનેડા ઇમર્જન્સી કમર્શ્યલ રેન્ટ અસિસ્ટન્સ (Canada Emergency Commercial Rent Assistance)([CECRA](#)) નો અમલ કરે. આ પ્રોગ્રામ નાના વ્યવસાયોના ભાડાના ખર્ચમાં 75 ટકા જેટલી રાહત કરી આપશે જેઓ COVID-19થી અસરગ્રસ્ત થયા હોય.

નવો CECRA પ્રોગ્રામ ખૂબ જરૂરી હતી એવી મદદ બ્રેમ્પટનના લઘુ વ્યવસાયોને પૂરી પાડશે અને તે બિન-અનિવાર્ય વ્યવસાયોને બંધ રાખવાની ઘોષણા થઈ ત્યારથી જે પગલું લેવા માટે સિટી હિમાયત કરી રહ્યું હતું તેનું પરિણામ છે. 1લી એપ્રિલે મેયર બ્રાઉને પ્રમુખશ્રી ફોર્ડ અને મંત્રીશ્રી ક્લાર્કને લઘુ વ્યવસાયો માટે ભાડાની રાહત આપવાની હિમાયત કરતો પત્ર પાઠવ્યો હતો. માર્ચમાં જ્યારથી COVID-19 મહામારી જાહેર થઈ ત્યારથી ભાડા રાહત લઘુ વ્યવસાયો માટે એક સળગતી સમસ્યા રહી છે. એપ્રિલની 17મીએ જ્યારે ઇકોનોમિક સપોર્ટ ટાસ્ક ફોર્સ સ્મોલ બિઝનેસ ટેલિ ટાઉન હોલ હાથ ધરવામાં આવી ત્યારે જે મતો લેવામાં આવ્યા તેમાં 73 ટકા સહભાગીઓએ જણાવ્યું હતું કે તેઓને કોઈપણ પ્રકારની ભાડાની રાહત મળી નથી. મેયરની COVID-19 ઇકોનોમિક સપોર્ટ ટાસ્ક ફોર્સની તમામ બેઠકોમાં ફેડરલ અને પ્રોવિન્શ્યલ પ્રતિનિધિઓ સાથે આ સમસ્યાની ચર્ચા થતી આવી છે.

આ [મેયરનો COVID-19 ઇકોનોમિક સપોર્ટ ટાસ્ક ફોર્સ \(Mayor's COVID-19 Economic Support Task Force\)](#) એવા ચાર ટાસ્ક ફોર્સ પૈકી એક છે જે COVID-19ના પ્રભાવ સામે લઢી રહેલા બ્રેમ્પટનનાં રહેવાસીઓ અને વ્યવસાયોને મદદરૂપ થવા સર્જ્યા હતાં. ઇકોનોમિક સપોર્ટ ટાસ્ક ફોર્સ બ્રેમ્પટનમાં વ્યવસાય રાહત પ્રયાસોમાં મદદ પૂરી પાડતી ભલામણો અને પગલાંના સંકલન માટે જવાબદાર છે. ટાસ્ક ફોર્સમાં COVID-19 ના પ્રારંભકાળથી બ્રેમ્પટનનાં વ્યવસાયોને મદદરૂપ થવામાં સક્રિય છે એવા ફેડરલ અને પ્રોવિન્શ્યલ સરકારોના પ્રતિનિધિઓ તેમજ બ્રેમ્પટન બોર્ડ ઓફ ટ્રેડ, ડાઉનટાઉન બ્રેમ્પટન બિઝનેસ ઇમ્પ્રૂવમેન્ટ અસોસિએશન (BIA) અને કેનેડિયન બ્લેક ચેમ્બર ઓફ કોમર્સ (CBCC) જેવા ભાગીદારો છે. ટાસ્ક ફોર્સે લઘુ વ્યવસાયો સાથે બે ટેલિ ટાઉન હોલ બેઠકો કરી છે જેમાં સંયુક્તપણે કુલ 500 વ્યવસાયોએ ભાગ લીધો હતો તેમજ બીજા બે રેસ્ટોરન્ટ સેક્ટર અને મોટા વ્યવસાયોમાંથી હતાં. ઉપરાંત, COVID-19 ના પ્રારંભકાળથી અત્યાર સુધીમાં કર્મચારીઓએ બ્રેમ્પટનના વ્યવસાયો તરફથી મળતી 1,200 જેટલી પૂછપરછોનાં જવાબ આપ્યા છે.

અવતરણો

"આપણા વ્યવસાયો આપણા સમાજની એકંદર સુખાકારી માટે અત્યંત મહત્વપૂર્ણ છે અને આ COVID-19ની કટોકટી શરૂ થઈ ત્યારથી અમે તેઓને ટેકો પૂરો પાડવા તેમજ તેઓ માટે હિમાયત કરવા માટે અમારાથી થાય એટલું બધું જ કરી છૂટ્યા છીએ. અમને આનંદ છે કે અમારા પ્રયાસો એવા દેખીતા પગલાં તરફ દોરી જાય છે જેનાથી આપણી વેપારી આલમમાં ફરક પડશે. અમારા ઇકોનોમિક ટાસ્ક ફોર્સમાં રહેલ ફેડરલ અને પ્રોવિન્શ્યલ પ્રતિનિધિઓ, MP કમલ ખેરા, MPP પ્રબમીત સરકારિયા તેમજ બ્રેમ્પટન બોર્ડ ઓફ ટ્રેડ, ડાઉનટાઉન બ્રેમ્પટન BIA અને

કેનેડિયન બ્લેક ચેંબર ઓફ કોમર્સનો લું આભારી છું જેઓએ અમારી સાથે મળીને ઉકેલો શોધવા માટે કાર્ય કર્યું. COVID-19 એક આર્થિક અભિશાપ પુરવાર થયો છે અને આપણે આપણા રહેવાસીઓ અને વ્યવસાયોને મદદ કરવા એકજૂટ થવું જ રહ્યું."

- પૅટ્રિક બ્રાઉન, મેયર, સીટી ઓફ બ્રમ્પટન

"બધાને માટે આ અત્યંત તાણમય સમય છે – ખાસ કરીને આપણા ધંધાદારીઓ અને ઓપરેટરો. આ સમગ્ર કટોકટી દરમિયાન અમે આપણા ધંધાદારી સમાજ સાથે નોંધપાત્ર રીતે પ્રવૃત્ત રહ્યા છીએ અને અમે તેમની સમસ્યાઓને ધ્યાન પર લીધી છે. તેઓને પોતાના વ્યવસાયો, તેઓના કર્મચારીઓ અને તેમના ભવિષ્યની ચિંતા સતાવે છે. હવે અમે તેમને મદદરૂપ થતા રહીશું અને સાથે જ આના નિરાકરણ અને આપણા માટે ઊભી થનાર નવતર સામાન્ય સ્થિતિ તરફ કાર્ય કરતા રહીશું. અમને આનંદ છે કે આ નવો પ્રોગ્રામ ઘણાં લોકોને નોંધપાત્ર અને તાકીદની રાહત પૂરી પાડશે.

- પૉલ વિસેન્ટ, રીજનલ કાઉન્સિલર વૉર્ડ 1 અને 5, સીટી ઓફ બ્રમ્પટન અને સહ-પ્રમુખ, મેયરનો COVID-19 ઈકોનોમિક સપોર્ટ ટાર્ક ફોર્સ

"જોકે, આ કટોકટી આમ તો આપણા સમાજમાંથી કેટલાયે લોકો માટે અત્યંત પડકારરૂપ રહી છે, આપણે આમાં માનસિક સ્થિતિસ્થાપકતા, કડ્ડણા અને સામાજિક એકજૂટતાના દર્શન પણ કરી શક્યા છીએ. આવા સમયે જ્યારે કેટલાક ભારે જાહેમત ઉઠાવી રહ્યા છે ત્યારે કેટલાકે તેમના વ્યવસાયોને દિશા આપીને આ પડકારને ઝીલી લઈને કટોકટીમાં મદદરૂપ થયા છે તેમજ ખાદ્ય પદાર્થો અને આર્થિક દાન આપ્યા છે. અમે આપણા સમાજને અમારાથી બને એટલી મદદ કરતા રહીશું અને લું જાણું છું કે આપ પણ એક બીજાને મદદરૂપ થતા રહેશો અને આપણે સહુ આમાંથી સુખરૂપ બહાર નીકળી શકીશું."

- માર્કવ પેલેશી, રીજનલ કાઉન્સિલર વૉર્ડ 2 અને 6, સીટી ઓફ બ્રમ્પટન અને સહ-પ્રમુખ, મેયરનો COVID-19 ઈકોનોમિક સપોર્ટ ટાર્ક ફોર્સ

-30-

મિડિયા સંપર્ક :

મોનિકા ડુગ્ગલ (Monika Duggal)

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રમ્પટન

905-874-3426 | Monika.Duggal@brampton.ca